



**PBT-1601300102030500** Seat No. \_\_\_\_\_

**M. A. (Sem. III) (CBCS) (W.E.F. 2016) Examination**

November / December - 2018

**Geography : Paper - 11**  
*(Climatology) (New Course)*

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70]

- સૂચના :** (૧) બધા પ્રશ્નો ફરજિયાત છે.  
(૨) જરૂર જણાય ત્યાં સ્વચ્છ આકૃતિ દોરો.

૧ આબોહવાશાસ્ત્રની વ્યાખ્યા અને કાર્યક્ષેત્ર પર વિગતે ભौગોલિક નોંધ લખો. ૧૪

**અથવા**

૧ સૂર્યાંધાતનો અર્થ સમજાવી, તેના વિતરણ પર અસર કરતાં પરિબળોની વિગતે ચર્ચા કરો. ૧૪

૨ દબાણ પર અસર કરતાં પરિબળો વિગતે સમજાવી, દબાણ-પણાઓની માહિતી ટૂંકમાં આપો. ૧૪

**અથવા**

૨ વર્ષણ એટલે શું ? તેની પ્રક્રિયા સમજાવી, તેના વિવિધ સ્વરૂપોની માહિતી આપો. ૧૪

૩ ધનીભવનના વિવિધ સ્વરૂપોનું વિગતે વર્ણન કરો. ૧૪

**અથવા**

૩ 'કોપેન'ના આબોહવાના વર્ગીકરણની વિસ્તૃત ચર્ચા કરો. ૧૪

૪ 'ઉષ્ણ કટિબંધીય ચકવાતો સમશીતોષ્ણ ચકવાતો કરતા વધુ તોઝાની હોય છે.' આ વિધાન વિગતે સમજાવો. ૧૪

**અથવા**

૪ વિશ્વની બદલાતી આબોહવાનાં સંદર્ભમાં માનવીનો રહેલો ફાળો વિગતે સમજાવો. ૧૪

૫ નીચેનામાંથી કોઈપણ બે પર નોંધ લખો : ૧૪

- (૧) પૃથ્વીનું ગરમી બજેટ
- (૨) વિશ્વમાં વરસાદનું વિતરણ
- (૩) વાયુ સમુચ્ચ્યમોનું વર્ગીકરણ
- (૪) આબોહવાશાસ્ત્રની વ્યવહારિકતા.

## ENGLISH VERSION

**Instructions :** (1) All questions are compulsory.  
(2) Draw neat diagrams wherever necessary.

- 1 Write a geographical note on the definition and scope of climatology in detail. 14

**OR**

- 1 Explain the meaning of Insolation and discuss in detail the factors affecting on the distribution of Insolation. 14

- 2 Explain in detail the factors affecting on the pressure and give the information of pressure belt in brief. 14

**OR**

- 2 What is precipitation ? Explain the process and give information of the different forms of precipitation. 14

- 3 Describe in detail the different forms of condensation. 14

**OR**

- 3 Discuss in detail the “Koppens” classification of climate. 14

- 4 “Tropical cyclones are more furious than the temperate cyclones” – Elaborate the statement. 14

**OR**

- 4 Explain in detail the role of Man with special reference to global climate change. 14

- 5 Write notes on any **two** of the following : 14

- (1) Heat Budget of the Earth.
- (2) Distribution of Rainfall in the world.
- (3) Classification of air masses.
- (4) Applied climatology.